



ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અંતર્ગત કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત

રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની સ્વાયત સંસ્થા “ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન” દ્વારા રાજ્ય અને જિલ્લાઓમાં તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરારથી નીચે મુજબની જગ્યાઓ ભરવા અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.

ક્રમ	જગ્યાનું નામ	જગ્યાની સંખ્યા	માસિક ફિક્સ મહેનતાણું	કક્ષા
૧	પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર-ટેન્ડર એન્ડ પ્રોક્યોરમેન્ટ	૦૧	રૂ. ૨૫,૦૦૦/-	રાજ્ય
૨	પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર-HR	૦૧	રૂ. ૨૫,૦૦૦/-	રાજ્ય
૩	પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર - પ્લાનીંગ એન્ડ ટ્રેનીંગ	૦૧	રૂ. ૨૫,૦૦૦/-	રાજ્ય
૪	પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર - ફાઈનાન્સ	૦૧	રૂ. ૩૫,૦૦૦/-	રાજ્ય
૫	પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર - MIS	૦૧	રૂ. ૨૫,૦૦૦/-	રાજ્ય
૬	પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર - આસીસ્ટન્ટ	૦૫	રૂ. ૧૨,૦૦૦/-	રાજ્ય
૭	જિલ્લા કો-ઓર્ડિનેટર	૧૨	રૂ. ૧૫,૦૦૦/-	જિલ્લા
૮	આચાર્ય (મોડલ ડે સ્કૂલ)	૧૮	રૂ. ૨૨,૫૦૦/-	જિલ્લા
૯	જેન્ડર કો-ઓર્ડિનેટર (મહિલા ઉમેદવાર માટે જ)	૦૨	રૂ. ૧૩,૦૦૦/-	જિલ્લા
૧૦	જિલ્લા હિસાબી અધિકારી	૦૮	રૂ. ૧૨,૦૦૦/-	જિલ્લા

ઉક્ત જગ્યાઓની હાલની પરિસ્થિતિની અને ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે મેરીટ યાદી અને પ્રતિજ્ઞાયાદી તૈયાર કરવા ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે (કોન્ટ્રાક્ટ બેઝ) ભરતી માટે નિયત કરેલ લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉમેદવારે એક જ જગ્યા માટે માત્ર એક જ અરજી કરવાની રહેશે. એક કરતા વધુ જગ્યા માટે અરજી કરેલ હશે તો ઉમેદવારે છેલ્લે કરેલ અરજીને માન્ય ગણવામાં આવશે.

મોડલ ડે સ્કૂલના આચાર્ય માટેની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૪૫ વર્ષથી વધુ નહીં. અને તે સિવાય તમામ ઉમેદવારની માટેની વયમર્યાદા ૩૫ વર્ષથી વધુ નહીં.

ઉમેદવારોએ ઓનલાઈન (ONLINE) અરજી, www.rmsagujarat.in અથવા www.cos.gujarat.gov.in વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઓનલાઈન અરજી માટેની ખાલી જગ્યાની સંખ્યા, આવશ્યક લાયકાત, જિલ્લા અને શાળાઓની યાદી, અરજી કરવાની રીત, ભરતી નિયમો અને શરતોની સુચના વેબસાઈટ પર મુકેલ છે, જેનો પુરેપુરો અભ્યાસ કરીને અરજી કરવાની રહેશે.

ઓનલાઈન (ONLINE) અરજી કરવાની તારીખ: ૧૫/૦૨/૨૦૧૬ (૧૧:૦૦ કલાક) થી તારીખ: ૨૪/૦૨/૨૦૧૬ (૨૩:૫૯ કલાક) સુધી. પોસ્ટમાં અરજી ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૬/૦૨/૨૦૧૬ સુધી

સહી/-
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
આર.એમ.એસ.એ